

જોએન એસ. કુનિયન્સ્કી સમાજવાદી કામદાર પક્ષ

જોએન એસ. કુનિયન્સ્કી એ એક સંગઠનનાં લડવૈયા છે કે જેણે ઓઈલ રીફાઈનરીઓ, રેલમાર્ગો, માંસનાં પેકિંગમાં કામ કર્યું છે. તે હાલમાં વોલમાર્ટની એક ડીલી-વર્કર છે.

સમાજવાદી કામદારોનો પક્ષ અલાબામા કોલસાના ખાણીયાઓથી લઈને નેબીસ્કો કામદારો સુધી હડતાલ કરીને આજના શ્રમિકોની લડાઈઓ સાથે એકતાનું નિર્માણ કરે છે. સખત મહેનતથી મેળવેલા લાભો છોડી દેવાની માંગ કરતા માલિકો તરફથી તેમની જાતનું રક્ષણ કરવાની બાબતનો કામદારો સામનો કરે છે. કુનિયન્સ્કીએ ખાણીયાઓની સહાયક રેલીમાં જોડાવા માટે અલાબામા સુધી મુસાફરી કરી હતી અને તેણીના સાથી કામદારો પાસેથી તેમના હળતાળ ફંડમાં મદદ અને ફાળાનાં સંદેશાઓ મેળવ્યા હતા.

સંગઠનોએ કામદારોને રસી લીધા બાદ કામ ઉપર પાછા જવા માટે દોરવા જોઈએ, આપણી જાતને માલિકોનાં હુમલાઓ સામે લડવા માટેની ઉત્તમ સ્થિતિમાં મૂકીને અને નિર્દયતાનો સામનો કરવા માટે સંગઠનનાં સંઘર્ષો, લડાઈઓ સાથે એકતાનું નિર્માણ કરવા માટે.

લાખો બેરોજગાર લોકો અને વધતા કુગાવા સાથે, સંગઠનોએ સંઘ કક્ષાના વેતનોમાં, દવાખાનાઓ, શાળાઓ, નિવાસ બાંધવા કે જેની કામદારોને જરૂર છે તેના માટે સમવાયી રીતે નાણા અપાયેલા કામના કાર્યક્રમ માટે લડાઈ કરવાની જરૂર છે. હડતાલોને રોકવા માટે પગારમાં કોઈ કપાત વિના કાર્ય સપ્તાહને ટૂંકો કરવો! દરેક કરારમાં જીવન નિર્વાહના ખર્ચની કાયદાકીય જોગવાઈઓ કે જે દરેક કિંમત વધારાની ભરપાઈ કરવા માટે પગાર અને નિવૃત્તિના લાભોને વધારે છે!

કામદારોએ માલિકોના ડેમોક્રેટિક કે રિપબ્લિકન પક્ષોમાંથી છૂટા થઈને આપણા સંગઠનો ઉપર આધારિત, આપણો પોતાનો એક રાજકીય પક્ષ, બનાવવો જોઈએ. SWPનો હેતુ મૂડીવાદી વર્ગ દ્વારા શોષિત આવા તમામને એક કરવાનો અને તેમના શાસનને સ્થાને કામદારોની અને ખેડૂતોની સરકાર દ્વારા બદલાવવાની જરૂરનો છે. હરિકેન ઈંડાનાં પરિણામ સ્વરૂપે થયેલા મૃત્યુઓ મૂડીવાદી શાસનનું અને તેનો બચાવ કરતા તમામ પક્ષોનું એક તહોમતનામું છે. કામદારોને તેમની કારોમાં મિટાવી દેવામાં આવ્યા, ભોયરાવાળા એપાર્ટમેંટસમા ડૂબાડી દેવામાં આવ્યા. હજારોને તેમના માટે ઉપજીવિકા મેળવવા, બેઘર અને વીજળી વિના છોડી દેવામાં આવ્યા હતા. તૈયારીનાં ઘાતક અભાવ અને વિલંબિત સરકારી પ્રતિભાવે “કુદરતી” આપત્તિને એક સામાજિક આફતમાં પલટાવી હતી.

ક્યુબામાં રહેલી સરકાર જીવનના નહીવત નુકશાન સાથે કુદરતની પ્રાણ ઘાતક તાકાતોનો સામનો કરવા માટે કામદારો અને ખેડૂતોને સંગઠિત કરે છે. તે એટલા માટે સંભવ છે કારણ કે કામદારોને તેમના સામ્યવાદી નેતાગીરી દ્વારા એક સમાજવાદી ક્રાંતિ કરવા માટે સંગઠિત કરવામાં આવ્યા હતા – મૂડીવાદીઓ પાસેથી રાજકીય સત્તાને તેમના પોતાના હાથમાં લેવા અને કારખાનાઓ, જમીન અને બેંકો ઉપર અંકુશ મેળવવા માટે, પ્રક્રિયામાં

તેમની જાતને રૂપાંતરિત કરીને. મારું અભિયાન તે ઉદાહરણનું અનુકરણ કરતા અને અહીં એક પક્ષનું નિર્માણ કરતા કે જે લાખો લોકોને સમાજવાદી ક્રાંતિ કરવા દોરે તેના માટે અમેરિકામાં કામ કરતા લોકોની જરૂરીયાતને દર્શાવવાનું છે

તે માર્ગ ઉપર કામ કરતા લોકોએ સ્ત્રીઓની મુક્તિને મેળવવા માટે અનિવાર્ય એવા સલામત અને સુરક્ષિત જન્મ નિયંત્રણ અને ગર્ભપાત સહીત, સ્ત્રીઓના અધિકારો માટે લડત કરવાની જરૂર છે. ગર્ભપાત પસંદ કરવા માટેના અધિકાર ઉપરના વર્તમાન હુમલાઓનો વિરોધ કરો.

કામદાર વર્ગને આપણી પોતાની વિદેશ નીતિની જરૂર રહે છે, આપણે સમગ્ર વિશ્વમાં કામદાર વર્ગ સાથે સામાન્ય વર્ગના હિતોનું આદાન-પ્રદાન કરીએ છીએ. આપણે વોશિંગટનનાં બધા યુદ્ધોનો વિરોધ કરીએ છીએ અને તેના ક્યુબા ઉપરના પ્રતિબંધની અને ઈરાન, વેનેઝુએલાને ઉત્તર કોરીયાના લોકો ઉપર તે જે પ્રતિબંધો લાદે છે તેની તાત્કાલિક સમાપ્તિની માંગ કરીએ છીએ.

SWP યહૂદીઓ માટે આશરા તરીકે ઇઝરાયલનાં બિનશરતી સ્વીકારની માંગ કરે છે. અમે યહૂદીઓ પ્રત્યેના ધિક્કારનો વિરોધ કરવા માટે સંગઠનોને વિનંતી કરીએ છીએ – આગળ વધતા વર્ગના હિતો અને તમામ કામદારોની એકતા અને મહેનત કરતા ખેડૂતો માટે એક ઘાતક જોખમ.

njswpcampaign@gmail.com, 551-240-1512, www.themilitant.com

ધી ટ્રયુજસીર કેમપેન કોર્ટ્રીનયશસ ડુ એસ એક્સપેરિસ યસર્ િરપોરિટરંગ એક્ટ, N.J.S.A. 19:44A-37, આ રાઠયના મતદારોને ગવર્નર પદ માટે ઉમેદવારો વગરેના તેમના િનણર્યોમાં મદદ કરવા, ઉમેદવારોને 500 શળદોથી વધારે નહીં એવું િનવેદન પડું ડુ પાડવાની પરવાનગી આપે છે. નીચેના િનવેદનો રજુ થયા છે.